

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન COVID-19નો સામનો કરવા માટે ઘોષીત કટોકટીની સ્થિતિ સમાપ્ત કરે છે.

બ્રેમ્પટન, ઓન્ટારિયો (24 માર્ચ 2022) – COVID-19ની મહામારીનો સામનો કરવા માટે કટોકટી જાહેર કર્યા પછી બે વર્ષે આજે મેયર પેટ્રિક બ્રાઉને સિટી ઓફ બ્રેમ્પટનની જાહેર કરેલ કટોકટીને સીટી કાઉન્સિલ વતી અને સિટીની ઇમર્જન્સી મેનેજમેન્ટ ટીમની ભલામણ બાદ સમાપ્ત થયેલ જાહેર કર્યું.

રિજન ઓફ પીલે પણ [આજે જાહેર કરેલ કટોકટીની સ્થિતિ સમાપ્ત કરી](#) જે મેડિકલ ઓફિસર ઓફ લેથ, ડૉ. લોરન્સ લોહ તેમજ રિજનલ ઇમર્જન્સી મેનેજમેન્ટ સાથે સલાહ મસલત બાદ કરવામાં આવી.

[સિટીએ 24 માર્ચ 2020ના રોજ કટોકટી જાહેર કરી હતી](#), જે સિટીની ઇમર્જન્સી મેનેજમેન્ટ પ્લાન અનુસાર કરવામાં આવી હતી. આ જાહેરાત પ્રોવિન્સ ઓફ ઓન્ટારિયો અને રીજન ઓફ પીલના COVID-19ના ફેલાવાને નિયંત્રિત કરવાના પ્રયાસોને ટેકો આપતું એક નોંધપાત્ર પગલું હતું. કટોકટીની જાહેરાત એક વહીવટી સાધન હતું જેથી સિટી ચપળતાપૂર્વક મહામારીનો સામનો કરી શકે જેથી સમુદાય સલામત રહી શકે.

સિટી આરોગ્ય અને સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરતું રહ્યું છે જ્યારે તેઓ ધીમે ધીમે અને સુરક્ષિત રીતે ફરીથી બંધુ ખોલવાનું ચાલુ રાખી રહ્યા છે, અને શારીરિક અંતર રાખીને ફેલાવાને રોકવામાં મદદ કરવા માટે, સ્વચ્છતાનો અભ્યાસ કરીને, રસી મેળવીને અને માર્સ્ક પહેરીને મહામારી દરમિયાન પોતાનો ભાગ ભજવવા બદલ રહેવાસીઓનો આભાર માને છે.

માંદગી દરમિયાન ઘરે રહીને અને રસીકરણ કરાવીને તથા COVID-19 સામે બૂસ્ટર ડોઝ લઈને રહેવાસીઓએ સહુ પ્રથમ સમુદાયના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખવું જોઈએ. COVID-19 રસીકરણો અંગે બિલકુલ અઘતન માહિતી માટે, અહીં મુલાકાત લો [પ્રોવિન્સનું રસી વિષયક પોર્ટલ](#).

જો બ્રેમ્પટનમાં COVID-19ની પરિસ્થિતિમાં પરિવર્તન આવે તો સિટી પીલ પબ્લિક હેલ્થ સાથે કાર્ય કરવું ચાલુ રાખશે અને તમામ પ્રોવિન્શલ અને પ્રાદેશિક આરોગ્ય અને સલામતીના પગલાં કટોકટીની પ્રતિક્રિયાને સહાય કરવા માટે અનુસરશે.

COVID-19 સપોર્ટ ટાસ્ક ફોર્સ

સમગ્ર મહામારી દરમિયાન, સ્ટાફ અને રહેવાસીઓના આરોગ્ય અને સલામતીનું રક્ષણ કરવા અને સ્થાનિક અર્થતંત્ર અને અપ્રમાણસર અસરગ્રસ્ત થયેલ સમુદાયોને સહાયતા આપવા માટે સિટી સમર્પિત રહ્યું છે. માર્ચ 2020માં, સિટીએ COVID-19 માટે અસરકારક પ્રતિભાવોનું સંકલન કરવા માટે મેયરના ચાર COVID-19 સપોર્ટ ટાસ્ક ફોર્સની જાહેરાત કરી હતી જેમકે ઈકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સ, સોશિયલ સપોર્ટ ટાસ્ક ફોર્સ, યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સ અને સિનિયર્સ સપોર્ટ ટાસ્ક ફોર્સ.

વિતેલ બે વર્ષથી બ્રેમ્પટનના સમુદાય અને COVID-19નો સામનો કરવાના પ્રયાસોમાં ટાસ્ક ફોર્સની સહાયતા કરતા તમામનો સિટી સહાયપૂર્વક આભાર માને છે.

- ઈકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સ સહ-લીડર્સ; પૉલ વિસેન્ટ, રિજનલ કાઉન્સિલર વોર્ડ 1 અને 5 અને માર્કલ પલેશી, રિજનલ કાઉન્સિલર વોર્ડ 2 અને 6
- સોશિયલ સપોર્ટ ટાસ્ક ફોર્સ સહ-લીડર્સ; રોવેના સાન્તોસ રીજનલ કાઉન્સિલર વોર્ડ 1 અને 5 અને જેક બોમેન, રીજનલ કાઉન્સિલર વોર્ડ 3 અને 4
- યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સ સહ-લીડર્સ; શરમેન વિલિયમ્સ, સિટી કાઉન્સિલર વોર્ડ 7 અને 8 અને હરકિરત સિંઘ, સિટી કાઉન્સિલર વોર્ડ 9 અને 10
- સિનિયર્સ સપોર્ટ ટાસ્ક ફોર્સ સહ-લીડર્સ; પેટ ફોર્ટિની, રિજનલ કાઉન્સિલર વોર્ડ 7 અને 8 અને ગુરપ્રીત ધિલ્લોન, રિજનલ કાઉન્સિલર વોર્ડ 9 અને 10
- બેંકચાર્ડ ગાર્ડન પ્રોગ્રામ પ્રમુખ; ડુગ વ્હિલાન્સ, સિટી કાઉન્સિલર વોર્ડ 2 અને 6
- રિઓપનિંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ લિડ; માર્ટિન મેડિરોસ, રિજનલ કાઉન્સિલર, વોર્ડ 3 અને 4

કટોકટીની સ્થિતિની સમાપ્તિ સાથે સિટી, ટાસ્ક ફોર્સનું સંક્રમણ કરશે અને સિટી સર્વિસ ડિલિવરી દ્વારા અને સામુદાયિક સામાજિક સપોર્ટ નેટવર્ક્સ દ્વારા સમુદાયને સમર્થન પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

COVID-19ના ચાલુ રહેલ પગલાં

રહેવાસીઓને સ્મૃતિ કરાવવામાં આવે છે કે જ્યારે સિટીએ તેનો [બ્રેમ્પટન COVID-19 ફરજિયાત માસ્ક બાય-લો](#) હટાવી લીધો છે, પબ્લિક ટ્રાન્ઝિટ, હેલ્થ કેર સેટિંગ્સ, લોંગ-ટર્મ કેર હોમ્સ અને કોંગ્રીગેટ કેર સેટિંગ્સ જેવી પસંદગીની સેટિંગ્સમાં માસ્કની આવશ્યકતા ચાલુ રહેશે. રહેવાસીઓને જણાવવામાં આવે છે કે જેઓ હવે જરૂરી ન હોય ત્યાં માસ્ક પહેરવાનું ચાલુ રાખવાનું પસંદ કરે તેમનો આદર કરવામાં આવે.

[પ્રોવિન્સના નિયમો](#)ને અનુરૂપ તમામ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ બસો અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ટર્મિનલ્સમાં માસ્કની આવશ્યકતા ચાલુ રહેશે. સફાઈ અને સ્વચ્છતા હજુ ચાલુ છે અને તેવી સુવિધાઓ અને ટર્મિનલો જ્યાં કઠણ સપાટીઓ હોય ત્યાં રોજ લૂછવામાં અને સ્વચ્છ કરવામાં આવે છે.

સર્વિસ અપડેટ્સ માટે www.bramptontransit.com ની મુલાકાત લો અથવા @bramptontransit ને Twitter પર ફોલો કરો. પ્રશ્નો 905.874.2999 પર બ્રમ્પટન ટ્રાન્ઝિટના કોન્ટેક્ટ સેન્ટરને નિર્દેશિત કરવા.

સિટીની સુવિધાઓમાં પ્રવેશ માટે હવે પછી પ્રિ-સ્ક્રીનિંગની જરૂર નથી જેમાં રિક્વિઝેશન સુવિધાઓનો સમાવેશ થાય છે. જો તેઓ અસ્વસ્થતા અનુભવતા હોય તો રહેવાસીઓને ઘરે રહેવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સુવાક્ષો

"હું એ જાહેરાત કરવા માટે ખૂબ જ આભારી છું કે અમે બ્રમ્પટનમાં COVID-19 નો સામનો કરવા માટે જાહેર કરેલી કટોકટીને સમાપ્ત કરવાની સ્થિતિમાં છીએ. જો અમારા રહેવાસીઓ, સિટી સ્ટાફ, હેલ્થ કેર વર્કર્સ અને સિટી ટાસ્ક ફોર્સના સભ્યોના ઉત્કૃષ્ટ કામગીરી માટે ન હોત તો આપણે આજે જ્યાં છીએ ત્યાં હોવું સંભવ ન હોત. જેમ જેમ આપણે મહામારીના આ આગલા તબક્કામાં સંક્રમણ કરીએ છીએ, ત્યારે હું જાણું છું કે આપણે તેમાંથી પસાર થઈ શકીશું જેમ આપણે છેલ્લા બે વર્ષથી કરી શક્યા છે – એક જ સમુદાય તરીકે."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"છેલ્લા બે વર્ષોમાં, સિટી ઓફ બ્રમ્પટન ખાતેની અમારી ટીમ આપણા રહેવાસીઓ અને વ્યવસાયો પર આધાર રાખે છે તે સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખીને આપણા સમુદાયના સ્વાસ્થ્ય અને સલામતીનું રક્ષણ કરવા માટે સતત પ્રતિબદ્ધ રહ્યા છે. હું હૃદયપૂર્વક તેમના પ્રયાસો માટે આભારી છું અને સિટી વતી અમે તે જોવા ઉત્સુક છીએ કે અમે આપણા સમુદાયોની સેવા કરવી ચાલુ રાખીશું જ્યારે આપણે મહામારીના આગામી ચરણમાં જઈ રહ્યા છીએ."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca